

:: આંક:૧ ની વિલંબ માફ કરવાની અરજી નીચે હુકમ ::

- (૧) આ કામના ફરીયાદીએ કંપની શ્રી રામ ફાઈનાન્સ લી.ના જે આરોપી /સામાવાળાને આપેલ લોનના હિસાબ પેટે રૂ.૬૭,૦૦૦/- નો ચેક આરોપીએ આપેલ. જે ચેક બેંકમા તા. ૧૩/૧૧/૨૦૨૫ ના રોજ જમા કરાવતા તા. ૧૩/૧૧/૨૦૨૫ ના રોજ પરત ફરેલ. જે ચેક પરત ફર્યા અંગેની તા.૨૯/૧૧/૨૫ ના રોજ ચેકની રકમ ચુકવી આપવા ડીમાન્ડ નોટિસ આપેલ.જે નોટિસ તા.૨/૧૨/૨૫ ના રોજ બજી ગયેલ.જેનું સ્ટેટસ ન આવતા વકીલશ્રી તા.૧૭/૧૨/૨૫ના રોજ પોષ્ટ ઓફીસમાં અરજી કરેલ.જેથી સદર સ્ટેટસ ફરીયાદીના વકીલશ્રીના ઓફીસે તા.૧૭/૦૧/૨૦૨૬ ના રોજ પહોંચેલ.જેથી નોટીસ બજયા તારીખથી તા.૧૬/૧૨/૨૦૨૫ ના રોજ પંદર દિવસ નોટીસ પીરીયડ બાદ ત્રીસ દીવસ ચાને તા.૧૫/૦૧/૨૦૨૬ સુધીમાં ફરીયાદ દાખલ કરવાની થતી હતી.પરંતુ નોટીસ બજી ગયેલાનું સ્ટેટસ અપડેટ ન થતાં ફરીયાદ દાખલ કરવાની તા.૧૫/૦૧/૨૦૨૬ થી ગણવામાં આવે તો સદર ફરીયાદ દાખલ કરવામાં સાત દીવસનો વિલંબ થયેલ.જેથી વિલંબ થયેલ હોય હાલની વિલંબ માફ કરવા અરજી કરેલ છે.
- (૨) સામાવાળા/આરોપીને નોટિસ કાઢવામાં આવતા તેઓને નોટીસ બજી ગયા છતાં સામાવાળા હાજર રહી અરજદાર/ફરીયાદીની અરજીનો લેખીત જવાબ/વાંઘા રજુ કરેલ નથી. જેથી સદર કામ સદર કેસની કાર્યવાહી આગળ ચલાવવામા આવેલ.
- (૩) અરજદાર/ફરીયાદી તર્ફ દલીલ કરી જણાવેલ છે કે, ફરીયાદીએ પોતાની અરજીમાં જણાવેલ હકીકતો મુજબની દલીલો કરી દિન-૭ નો વિલંબ થયેલ હોય હાલની વિલંબ માફ કરવા અરજી કરેલ છે. જેથી વિલંબનું વ્યાજબી કારણ હોય વિલંબ માફ કરવા રજુઆત કરેલ છે.
- (૪) ઉપરોક્ત રજુઆતો તથા અરજી તથા રજુ કરેલ દસ્તાવેજી પુરાવા ધ્યાને લેતા ફરીયાદીના ચેક બેંકમા તા. ૧૩/૧૧/૨૦૨૫ ના રોજ જમા કરાવતા તા. ૧૩/૧૧/૨૦૨૫ ના રોજ પરત ફરેલ. જે ચેક પરત ફર્યા અંગેની તા.૨૯/૧૧/૨૫ ના રોજ ચેકની રકમ ચુકવી આપવા ડીમાન્ડ નોટિસ આપેલ.જે નોટિસ તા.૨/૧૨/૨૫ ના રોજ બજી ગયેલ.જેનું સ્ટેટસ ન આવતા વકીલશ્રી તા.૧૭/૧૨/૨૫ના રોજ પોષ્ટ ઓફીસમાં અરજી કરેલ.જેથી સદર સ્ટેટસ ફરીયાદીના વકીલશ્રીના ઓફીસે તા.૧૭/૦૧/૨૦૨૬ ના રોજ પહોંચેલ.જેથી નોટીસ બજયા તારીખથી તા.૧૬/૧૨/૨૦૨૫ ના રોજ પંદર દિવસ નોટીસ પીરીયડ બાદ ત્રીસ દીવસ ચાને તા.૧૫/૦૧/૨૦૨૬ સુધીમાં ફરીયાદ દાખલ કરવાની થતી હતી.જે કરેલ નથી.એન.આઈ.એક્ટની કલમ-૧૪૨ ની જોગવાઈ જોતા 142. Cognizance of offences.—

—(a)no court shall take cognizance of any offence punishable under section 138 except upon a complaint, in writing, made by the payee or, as the case may be, the holder in due course of the cheque;(b)such complaint is made within one month of the date on which the cause of action arises under clause (c) of the proviso to section 138:

Provided that the cognizance of a complaint may be taken by the Court after the prescribed period, if the complainant satisfies the Court that he had sufficient cause for not making a complaint within such period.

જેથી ઉપરોક્ત જોગવાઈ ધ્યાને લેતા નિયમ સમયમાં ફરીયાદ કરેલ ન હોય અને પુરતા કારણો બતાવવામાં આવે તો ફરીયાદ દાખલ કરવામાં થયેલ વિલંબ માફ કરી શકાય છે. જેથી રજુ થયેલ પુરાવો તથા હકીકતો જોતા આ કામના અરજદાર/ફરીયાદીને ફરીયાદ દાખલ કરવા દિન-૭ નો વિલંબ થયેલાનું જણાવેલ છે. જેથી વિલંબનું કારણ જોતા ફરીયાદી બીમારીથી પીડાયેલ હોય ફરીયાદ નિયમ સમયમાં નહીં કરવા માટે વ્યાજબી તથા પુરતું કારણ હોવાનું મારું માનવું છે. જેથી હાલની અરજી મંજૂર થવા પાત્ર હોય નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

:: આખરી હુકમ ::

આથી અરજી મંજૂર કરવામાં આવે છે.ફરીયાદીની ફરીયાદ દાખલ કરવા થયેલ વિલંબ માફ કરી એન.આઈ.એક્ટની કલમ-૧૩૮ મુજબ ની ફરીયાદ દાખલ કરવા હુકમ કરવામાં આવે છે.

આ હુકમ આજરોજ તા.૦૧/૦૮/૨૦૨૬ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી મારી સહી કરી જાહેર કર્યો.

સ્થળ:મોડાસા

તા.૦૧/૦૮/૨૦૨૬

(એસ.આર.શર્મા)
એડી.જયુડી. મેજી. ફ.ક.,
મોડાસા
કોડ નં.જીજે ૦૧૫૭૧